



October 6, 2019

The General Manager
Department of Corporate Services
BSE Limited
Phiroze Jeejeeboy Towers, Dalal Street,
Mumbai – 400001.

Scrip Code: 540268

Dear Sir / Madam,

Subject: Board Meeting Intimation – Publication in Newspaper

This is with reference to our letter dated October 5, 2019 intimating the date of Board Meeting to consider and approve, inter alia, the unaudited financial results (subjected to limited review by the Auditors) for the quarter ended September 30, 2019 and fund raising by issue of securities through permissible mode.

In compliance of Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company has issued notice of the aforesaid Board Meeting in the following newspapers on October 6, 2019:

1. Financial Express (English) – all editions and
2. Gujarat Today (Vernacular language in Gujarati) – Ahmedabad Edition.

Copies of the aforesaid publications are attached herewith.

We request you to take the aforesaid information on record.

Thanking you.

Yours faithfully,

For Dhanvarsha Finvest Limited


M Vijay Mohan Reddy
Company Secretary
ACS 49289



Encl: as above

Dhanvarsha Finvest Limited

CIN: L24231GJ1994PLC023528

Regd. Off. : B Wing, 813/2, Mondeal Square, Opp. Karnavati Club, S G Highway, Ahmedabad-380015, GJ.
Corp. Off. : 2nd Floor, Bldg. No 4, Wilson House, Old Nagardas Road, Andheri (East), Mumbai-400069, MH.

Tel: 079 4032 0311 | 022 2826 4295 | contact@df ltd.in | www.df ltd.in

Accelerating times for this part of Motown

Speaking about the effects of slowdown on the used car market, Ashutosh Pandey, CEO, Mahindra First Choice Wheels said, "Used vehicles have a much larger car parcel and, therefore, the impact of slowdown in new cars generally affects used car market with a time lag." Sunil Kataria, VP Auto, OXL Group said, "The slowdown in the new car market borders well for pre-owned car market. Whenever there is a slowdown in the economy, users tend to scout for deals. A pre-owned car on an average is about 20-30% cheaper than a new car, hence for users it serves as an incredible value proposition."

As per an Edelweiss Securities report, the pre-owned car market was 1.2 times that of new cars in 2016. The growth rate of the pre-owned car market is expected to continue to medium term due to certain factors. A rise in share of organised players in the pre-owned car market is expected to trust. Increase in the total cost of ownership for new cars due to insurance cost and taxes may also be used as a more compelling reason for buying pre-owned cars. The report to BS-VI from April 2020 would also increase the price differential between new and used cars. The market was also boosted by reduction in government taxes on used cars. The market share of cars from 28% to 12% in 2018, depending on size of the engine. In January 2018 of the engine. The market growth is expected to be given by rising penetration of online platforms, which enabled used car dealers to reach large audiences. However, Edelweiss analysts claim that, finding a car for sale in the pre-owned car market is still 17% lower, when compared to 75% in the new car market. With increasing number of organised players in the pre-owned car market, the risk is expected to increase. Pandey added, "We take steps to ensure that risks are minimised for banks when they come in financing through rigorous car financing checks. The industry ensures that the vehicle sold is really worth the price."

5G rollout: Huawei finds support from telecom industry

"I use all three of them. My view is that they should be in play. I really feel they should be in play. India must use this as leverage," Mittal said. Mittal's statement comes at a time when the department of telecommunications (DoT) is understood to have rejected applications of

Huawei and ZTE to 5G trials in the upcoming India Mobile Congress (IMC), which will be held in Delhi October 14-16. The applications have been rejected citing technical reasons and, therefore, these firms are not participating in the IMC. The DoT has rejected three applications – one each of Huawei and ZTE and the third on which neither Airtel and Huawei had jointly applied. Applications of the other two firms, Reliance and Ericsson have been approved and spectrum has been also allocated to these firms. Queries sent to Huawei and ZTE remained unanswered till the time of the IMC. The DoT source said Bharti Airtel has applied for conducting trials with all the three network providers but its application with Huawei has been rejected. The other two firms, Reliance and Ericsson have been approved. The individual applications of Nokia and Ericsson have also been approved and the firms have been allocated 40 MHz spectrum each to do 4G-LTE trials in the 1800-1900 MHz band, 30 MHz spectrum in 3400-3600 MHz band that can be allocated to companies for trials during the event. Of the total available spectrum, 160 MHz has also been allocated to Airtel, Nokia and Ericsson.

'Over 90% of promoter stake in Zee pledged'

Shas of Zee Entertainment Enterprises (ZEE), have fallen by nearly 50% since January this year, mainly piling debt woes on the Subhash Chandra-led Essel Group. The current outstanding debt of the Essel Group is at ₹7,000 crore (loan against shares) while the value of the promoter group's stake is valued at ₹5,000 crore. When asked how the Essel Group proposed to reduce debt given the challenging environment and delay in the sale of non-media assets, Goenka said, "We are looking at all problems. Whatever stake promoters are left with, I am committed to the company. If process allows, I will continue to run the company. We are looking to resolve this in three months." Goenka also expressed hope that the lender would continue to support the management in the long-term interest of the company.

While some of the lenders to Essel Group in India may have agreed to a standstill, it is not clear whether VTB Capital has

ago along to similar agreements. The company and nor was it clear if the covenants had been breached. Too. Commenting on the indirect red pledge that VTB Capital had on its shares, Goienka said that the company had not been informed. But with Sel's new normal on such disclosures, Goienka added that these disclosures would be made. Interestingly, VTB Capital can invoke and sell the shares if the company or any of its other lenders have done so. Its covenants are breached, however, if maturity was a year away. He did not confirm if the company had been breached for VTB Capital. He said that in the last one year, they can sell shares directly. VTB is a long-term investor and has hoped that the investor and I hope they will work in the same way." Any possible breach of the covenants, however, was not pledged was also ruled out by Goienka on Saturday. Several mutual fund houses have held the shares of ZEE as collateral against their exposure to the company. Goienka said that the company had breached the September 30 deadline, promoters were to sell up to 11% of their holdings in ZEE to US-based Investors. Open Fund Development Pvt. Ltd., a US-based investor, had the stake sale. Essel Group had sold 8.7% of its holdings to the US fund. However, as the company found an interim trading window for an insulating stake cooling-off period, the sale did not go through. Goienka said that the company had not breached the September 30 deadline, however, as the company had found an interim trading window. Investors Openheimer amounting to nearly 74,000 crore, the company could not pay back the loan. Goienka said that the company had not breached the September 30 deadline, however, as the company had found an interim trading window. Investors Openheimer amounting to nearly 74,000 crore, the company could not pay back the loan. Goienka said that the company had not breached the September 30 deadline, however, as the company had found an interim trading window. Investors Openheimer amounting to nearly 74,000 crore, the company could not pay back the loan.

**Bangladesh, India
sign seven pacts to
broadbase ties**

Both leaders reiterated their strong commitment to eliminate terrorism in all its forms and manifestations, and stressed that there can be no justification whatsoever for any act of terror. After the talks, Modi and Hasina, through video link, launched a project to import LPG from Bangladesh for distribution in the north-eastern states, inaugurated at Vivekananda Bhaban at

Ramakrishna Mission in Dhaka
and unveiled a skill develop-
ment institute at Khulna.

India accords priority to its ties with Bangladesh. The increasing cooperation between India and Bangladesh is a shining example of neighbourly relations for the entire world, Modi said in a brief media statement. In presence of Hasina, he said Saturday's talks will further the ongoing bilateral ties. The joint statement said Hasina highlighted that the people of Bangladesh are awaiting early signing of the Teesta water sharing agreement which was agreed upon by both the governments in 2011. Modi conveyed to Hasina that his government is working with all stakeholders in India for conclusion of the agreement at the earliest. The seven MoUs signed will provide deepening cooperation in areas of water resources, youth affairs, culture, education and coastal surveillance.

Another MoU will facilitate use of Chattogram and Mongla ports for movement of goods to and from India. A separate MoU will provide for withdrawal of 8.82 cusec of water from Feni river of Bangladesh for drinking purpose of the people of Sabroom town of Tripura. Modi and Hasina also agreed to expedite commissioning of the joint study on the prospects of entering into a bilateral Comprehensive Economic Cooperation and Trade Agreement (CEFTA) between India and Bangladesh. Both leaders directed their officials to expedite the establishment of framework of cooperation in the area of trade remedial measures for cooperation and capacity building in this area, said the joint statement.

PMC Bank former chairman arrested

Based on a complaint filed by the RBI-appointed administrator of the bank, the EOW registered the first information report under IPC Sections 409 (criminal breach of trust by a banker), 420 (cheating), and 465, 466 and 471 (related to forgery) along with 120 (b) (criminal conspiracy). The FIR named former PMC Bank chairman Waryam Singh, Thomas and other senior officials, besides the Wadhawan duo.

Film studios find new hit formula in OTTs

This makes the move all the more remarkable for large production houses. D2R Film Services launched its first web series, *Prison Break*, in 2005. The Prime Video on September 28, and is working on two to three series with the platform. To maintain high production quality, film makers have chosen to work on a per-episode basis at a time for a particular platform. This also helps in hedging risks. "We are very selective on which series we want to create and which ones we can monetize," says series workflow where other content makers have worked on them for more than a decade. It is a dramatic leap, says Adidimoru. Production houses are also working on deals with OTT platforms. For instance, the video streaming deal includes a modest premium over platform making the investment, owning the IP and the content. The production house to deliver the content. The production fee can be 10-15% of the overall budget of the show, which is a significant portion of the budget in some cases. There is another scenario where a film studio makes a show, bearing the cost, and later sells the rights to an OTT platform. This is the case with such series from D2R.

shows includes cinematic vision, high production value and better quality content. Reem's first show, *Chillies*, starring Emraan Hashmi, is estimated to have a production cost of ₹50 crore.

According to a KPMG report, the production cost of shows like *Made In Heaven* and *Mirzapur* is ₹1-2 crore per episode. Compare that to television shows, where, on an average, the cost is ₹10-15 lakh per episode.

Sl. No.	Name of the work
1	Construction of control Regulation Old Coleroon Canal point with Coleroon near Panchayati Keezhakundalappai in Chidambaram Cuddalore District

fresh content and attract viewers," says Ashish Pherwan, partner, and media and entertainment leader, EY India. Vijay Subramaniam, director and content head, Amazon Prime Video, says, "Film studios know

the cinematic craft and they are able to bring that in this new format of storytelling." The OTT platform has worked with studios like Excel Entertainment, D2R Films and Abundantia Entertainment.

GOVERNMENT OF TAMIL NADU / WATER RESOURCES DEPARTMENT
D/o. THE SUPERINTENDING ENGINEER, P.W.O.R.D., VELLAR BASIN CIRCLE, CUDDALORE.

CORRIENDUM

Lr. No. CORNIT/24-2019-2020 : 04.10.2019 - Short Term Tender Notice No. 03/VSC/ - 2019/20 - dt. 04.10.2019
The following Corrigendum is being issued in the above tender notice:

FOR										
S/L	Name of work	Class of Contract category to participate in the tender	Approximate value of contract (in Lakhs) (or) QST	Period of completion (including monsoon period)	Last date of receipt of tender	Amount of Earnest Money Deposit in ₹	Period of availability of tender document to be submitted to the Executive Engineer	Earnest Money Deposit and cost of tender document to be credited to the Executive Engineer	Cost of tender QST in ₹	
1	2	3	4	5	6	7	8	9	10	
1	Preparation and formation of a New River Channel from Anuvattam near Kuppam Road and continuation of it through Chikkarai Near Kuppam Road upto Chikkarai Near Kuppam Road (about 1.5 Km) at Chikkarai Near Kuppam Road (about 1.5 Km).	First class state level	₹ 9400.00	24 Months	31.10.2019	₹ 47,60,000/-	05.10.2019	The Executive Engineer, WRO Circle, Cuddalore, Chidambaram	1500	

READ										
S/L	Name of work	Class of Contract category to participate in the tender	Approximate value of contract (in Lakhs) (or) QST	Period of completion (including monsoon period)	Last date of receipt of tender	Amount of Earnest Money Deposit in ₹	Period of availability of tender document to be submitted to the Executive Engineer	Earnest Money Deposit and cost of tender document to be credited to the Executive Engineer	Cost of tender QST in ₹	
1	2	3	4	5	6	7	8	9	10	
1	Construction of a Flood Control Dam across Confluence of Periyar & Aravali Rivers near Paramparathi and continuation of it through Chikkarai Near Kuppam Road upto Chikkarai Near Kuppam Road (about 1.5 Km).	First class state level	₹ 4100.00	24 Months	31.10.2019	₹ 21,80,000/-	05.10.2019	The Executive Engineer, WRO Circle, Cuddalore, Chidambaram	1500	

No changes in other terms and conditions of the original tender notice.

Superintending Engineer, P.W.O.R.D., Vellar Basin Circle, Cuddalore - 605 001.

DPP/S15/2019-2019

ICI Prudential Asset Management Company Limited
Corporate Identity Number: U99999DL1993PLC054135

Registered Office: 12th Floor, Narain Manzil, 25, Barakhamba Road, New Delhi - 110 001.
Corporate Office: One BKC, 13th Floor, Bandra Kurla Complex, Mumbai - 400 051.
Tel.: +91 22 2652 5000, **Fax:** +91 22 2652 8100, **Website:** www.icipruidam.com
Email: enquiry@icipruidam.com

Central Service Office: 2nd Floor, Block B, Niton Knowledge Park, Western Express Highway, Goregaon (E), Mumbai - 400 063. **Tel:** +91 22 2685 2000 **Fax:** +91 22 26868313

Notice to the unitholders of ICI Prudential Credit Risk Fund and ICI Prudential Medium Term Bond Fund (the Schemes)

Notice is hereby given to all the unitholders under the Schemes that the NAV's of all the plans of the said Schemes for October 3, 2019 were uploaded on the website of Association of Mutual Funds in India (AMFI) and ICI Prudential Asset Management Company Limited (the AMC) before 11 p.m., on October 3, 2019. Subsequently, on account of revision in price of two securities held by the Schemes, due to downgrade in their credit rating by a credit rating agency, on October 3, 2019, the NAV's of all the plans under the Schemes have been revised and re-uploaded on the website of AMFI and the AMC on October 4, 2019.

The Investors are requested to visit the AMC's website viz. www.icipruidam.com to check the NAV's of the plans under the Schemes as on October 3, 2019. It may be noted that all the transactions in the said schemes with NAV applicability of October 3, 2019 have been processed under the revised NAV.

For ICI Prudential Asset Management Company Limited
Place : Mumbai Sd/-
Date : October 5, 2019 Authorised Signatory
No. 07/10/2019

To know more, call 1800 222 999/1800 200 6666 or visit www.icipruidam.com

As part of the Go Green Initiative, investors are encouraged to register/update their e-mail id and mobile number with us. This will enable us to send you important information and to increase awareness about Mutual Funds, we regularly conduct Investor Awareness Programs to across the country. To know more about it, please visit <https://www.icipruidam.com/> or visit AMFI's website <https://www.amfiindia.com>

**Mutual Fund investments are subject to market risks,
read all scheme related documents carefully.**

<p align="center">FORM A PUBLIC ANNOUNCEMENT (Under Regulation 6 of the Insolvency and Bankruptcy Board of India (Insolvency Resolution Process for Corporate Insolvency) Regulations, 2016) FOR THE ATTENTION OF THE CREDITORS OF PURNA PHARMACEUTICALS PRIVATE LIMITED</p>	
<p align="center">RELEVANT PARTICULARS</p>	
1. Name of corporate debtor	PURNA PHARMACEUTICALS PRIVATE LIMITED 02/09/2008
2. Date of incorporation of corporate debtor	Registrar of Companies Kolkata
3. Authority under which corporate debtor is incorporated / registered	
4. Corporate Identity No. / Limited Liability Identification No. of corporate debtor	U85100WB2008PTC129015
5. Address of the registered office and principal office (if any) of corporate debtor	Registered Office: 71, Canning Street A-402/8, Bagree Market Kolkata WB 700007, INDIA 03/ October 2019
6. Insolvency commencement date in respect of corporate debtor	31 st March 2020 (18 th day from the Insolvency commencement date)
7. Estimated date of closure of insolvency resolution process	
8. Name and registration number of the insolvency professional acting as interim resolution professional	Name: Kinnan Truxingdiadm Registration No. IBBP/PA-01/PI-P00253/2017- 18/0482
9. Address and e-mail of the interim resolution professional, as registered with the Board	Address: Netaji Subhas Vihar flat No: 3 C, 3 rd Floor, 18 Karunamoyee Ghat Road Near Dhanspara Tollygunge, Kolkata, West Bengal, 700082 Email: calkannan@gmail.com
10. Address and e-mail to be used for correspondence with the interim resolution professional	Address: Netaji Subhas Vihar flat No: 3C, 3 rd Floor, 18 Karunamoyee Ghat Road Near Dhanspara Tollygunge, Kolkata, West Bengal, 700082 Email: carp.purna@gmail.com
11. Last date for submission of claims	17/ October 2019
12. Classes of creditors, if any, under clause (b) of sub-section (6A) of section 21, ascertained by the interim resolution professional	Not Applicable
13. Names of Insolvency Professionals identified to act as Authorised Representative of creditors in a class (Three names for each class)	Not Applicable
14. (a) Relevant Forms and (b) Details of authorized representatives are available at:	Web Link: https://www.ibbi.gov.in/home/downloads Physical Address: Netaji Subhas Vihar flat No. 3C, 3 rd Floor, 18 Karunamoyee Ghat Road Near Dhanspara Tollygunge, Kolkata, West Bengal, 700082

Notice is hereby given that the National Company Law Tribunal has ordered the commencement of a corporate insolvency resolution process of the PURNA PHARMACEUTICALS PRIVATE LIMITED on 03rd October 2019.

The creditors of PURNA PHARMACEUTICALS PRIVATE LIMITED are hereby called upon to submit their claims with proof on or before 17th October 2019 to the interim resolution professional at the address mentioned against entry No. 10.

The financial creditors shall submit their claims with proof by electronic means only. All other creditors may submit the claims with proof in person, by post or by electronic means.

A financial creditor belonging to a class as listed against the entry No. 12, shall indicate its choice of authorised representative from among the three insolvency professionals listed against entry No.13 to act as authorised representative of the class (specify class) in Form CA.

Submission of false or misleading proofs of claim shall attract penalties.

Sd/-
CA. Kannan Tiruvengadam
Interim Resolution Professional

PURNA PHARMACEUTICALS PRIVATE LIMITED (Corporate Debtor)
Membership No. - IBBU/PA-01/PA-00253/2017 - 18/10482
Netaji Subhas Vihar, Flat No. 3, C 3, 3rd Floor
Address - 18, Karunamoyee Ghat Road
Near Dharampra, Tollygunge
Kolkata - 700092

Date: 03rd October, 2019
Place: Kolkata

**BNP PARIBAS
MUTUAL FUND**

Investment Manager: BNP Paribas Asset Management India Private Limited (AMC)
Corporate Identity Number (CIN): U65931MH2003PT142972

Registered Office: BNP Paribas House, 1 North Avenue, Marikkar, Banda Kuria Complex,
Bandra - East, Mumbai - 400 051. Website: www.bnpparibasmf.in • Toll Free: 1800 102 2595

NOTICE ON ADDENDUM NO. 31/2019

Notice cum Addendum to the Statement of Additional Information (SAI) of BNP Paribas Mutual Fund (the Fund): Investors are requested to note that Mr. Anand Shah, Deputy CEO & Head of Investments, BNP Paribas Asset Management India Private Limited (AMC) has ceased to be the Director of the AMC, with effect from October 04, 2019 and Key Personnel of the AMC with effect from October 05, 2019.

Further, due to realignment of roles and responsibilities, Mr. Chockalingam Narayanan has been re-designated as Head of Equities with effect from October 05, 2019.

Note: This Notice cum addendum forms an integral part of the SAI of the Fund and addenda issued thereafter. All other terms and conditions mentioned in the SAI shall remain unchanged.


For BNP Paribas Asset Management India Private Limited
(Investment Manager to BNP Paribas Mutual Fund)

Sd/-

Yoshihiro Krishnan
Head of Corporate, Legal & Secretarial

Date : October 05, 2019
Place : Mumbai

**MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY**



CANARA ROBECO

Canara Robeco Mutual Fund

Investment Manager : Canara Robeco Asset Management Co. Ltd.

Constitution House, 4th Floor, 5, Walchand Hirachand Marg, Ballard Estate, Mumbai 400 001.

Tel.: 6658 5000 Fax: 6658 5012/13 www.canararobeco.com CIN No.: U65909MH1993PLC07003

NOTICE-CUM-ADDENDUM NO. 25

Change in Benchmark of Canara Robeco Equity Diversified Fund

All the Unit holders of Canara Robeco Mutual Fund are requested to take note of the following change in the Benchmark of Canara Robeco Equity Diversified Fund with effect from 7th October, 2019:

Scheme Name	Existing Benchmark	Revised Benchmark
Canara Robeco Equity Diversified Fund	S&P BSE 200 TRI	S&P BSE 500 TRI

All references to the existing Benchmark of the aforesaid Scheme in the Scheme Information Document ("SID") and Key Information Memorandum ("KIM") shall be construed as a reference to the revised Benchmark.

All other features and terms and conditions of the aforesaid Scheme shall remain unchanged. This Addendum shall form an integral part of the SID/KIM of the aforesaid Scheme as amended from time to time.

Unit holders are requested to visit www.canararobeco.com in respect of their accounts remaining undclaimed or unpaid and follow the prescribed procedure there.

For and on behalf of Canara Robeco Asset Management Company Ltd.

(Investment manager for Canara Robeco Mutual Fund)

Date: 05-10-2019

Place: Mumbai

sd/-

Authorised Signatory

Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.

RAMCO INDUSTRIES LIMITED
Reg. Office : 47, P.S. Nagar, Rajapalayam-626108.
(Tamil Nadu) CIN L26943TN1995PLC005297
Website : www.ramcoindia.com Email : ril@ril.co.in
NOTICE OF THE BOARD OF DIRECTORS OF RAMCO INDUSTRIES LIMITED
Further to the Notice of the Board Meeting published on 1.10.2019 at per Regulation 47(1)(a) of SEBI (Listing Obligations and Disclosures) Regulations, 2015, the Board of Directors of RAMCO INDUSTRIES LIMITED Meeting of the Board of Directors of the Company is rescheduled to be held on Wednesday the 30th October, 2019 instead of Thursday the 24th October, 2019. The Board Meeting of the Company is scheduled to discuss and approve the Consolidated Financial Results of the Company for the Quarter and six months ended 30th September, 2019.
The Notice is available on the Company's website at www.ramcoindia.com and the website of the Stock Exchanges where the shares of the Company are listed at www.bseindia.com and www.nseindia.com.

For RAMCO INDUSTRIES LIMITED
S. BALAMURUGASUNDARAM
Company Secretary, RAMCO INDUSTRIES LIMITED



MOIL LIMITED

(Formerly) Materials Dept. (India) Ltd.,
(A Government Enterprise)

MATERIALS DEPARTMENT
1-A, KATOL ROAD, AGRA-202 002
Tel: 2626061, 2626062, 2626063, 2626064, 2626065, 2626066, 2626067, 2626068, 2626069, 2626070, 2626071, 2626072, 2626073, 2626074, 2626075, 2626076, 2626077, 2626078, 2626079, 2626080, 2626081, 2626082, 2626083, 2626084, 2626085, 2626086, 2626087, 2626088, 2626089, 2626090, 2626091, 2626092, 2626093, 2626094, 2626095, 2626096, 2626097, 2626098, 2626099, 2626100, 2626101, 2626102, 2626103, 2626104, 2626105, 2626106, 2626107, 2626108, 2626109, 2626110, 2626111, 2626112, 2626113, 2626114, 2626115, 2626116, 2626117, 2626118, 2626119, 2626120, 2626121, 2626122, 2626123, 2626124, 2626125, 2626126, 2626127, 2626128, 2626129, 2626130, 2626131, 2626132, 2626133, 2626134, 2626135, 2626136, 2626137, 2626138, 2626139, 2626140, 2626141, 2626142, 2626143, 2626144, 2626145, 2626146, 2626147, 2626148, 2626149, 2626150, 2626151, 2626152, 2626153, 2626154, 2626155, 2626156, 2626157, 2626158, 2626159, 2626160, 2626161, 2626162, 2626163, 2626164, 2626165, 2626166, 2626167, 2626168, 2626169, 2626170, 2626171, 2626172, 2626173, 2626174, 2626175, 2626176, 2626177, 2626178, 2626179, 2626180, 2626181, 2626182, 2626183, 2626184, 2626185, 2626186, 2626187, 2626188, 2626189, 2626190, 2626191, 2626192, 2626193, 2626194, 2626195, 2626196, 2626197, 2626198, 2626199, 2626200, 2626201, 2626202, 2626203, 2626204, 2626205, 2626206, 2626207, 2626208, 2626209, 2626210, 2626211, 2626212, 2626213, 2626214, 2626215, 2626216, 2626217, 2626218, 2626219, 2626220, 2626221, 2626222, 2626223, 2626224, 2626225, 2626226, 2626227, 2626228, 2626229, 2626230, 2626231, 2626232, 2626233, 2626234, 2626235, 2626236, 2626237, 2626238, 2626239, 2626240, 2626241, 2626242, 2626243, 2626244, 2626245, 2626246, 2626247, 2626248, 2626249, 2626250, 2626251, 2626252, 2626253, 2626254, 2626255, 2626256, 2626257, 2626258, 2626259, 2626260, 2626261, 2626262, 2626263, 2626264, 2626265, 2626266, 2626267, 2626268, 2626269, 2626270, 2626271, 2626272, 2626273, 2626274, 2626275, 2626276, 2626277, 2626278, 2626279, 2626280, 2626281, 2626282, 2626283, 2626284, 2626285, 2626286, 2626287, 2626288, 2626289, 2626290, 2626291, 2626292, 2626293, 2626294, 2626295, 2626296, 2626297, 2626298, 2626299, 2626300, 2626301, 2626302, 2626303, 2626304, 2626305, 2626306, 2626307, 2626308, 2626309, 2626310, 2626311, 2626312, 2626313, 2626314, 2626315, 2626316, 2626317, 2626318, 2626319, 2626320, 2626321, 2626322, 2626323, 2626324, 2626325, 2626326, 2626327, 2626328, 2626329, 2626330, 2626331, 2626332, 2626333, 2626334, 2626335, 2626336, 2626337, 2626338, 2626339, 2626340, 2626341, 2626342, 2626343, 2626344, 2626345, 2626346, 2626347, 2626348, 2626349, 2626350, 2626351, 2626352, 2626353, 2626354, 2626355, 2626356, 2626357, 2626358, 2626359, 2626360, 2626361, 2626362, 2626363, 2626364, 2626365, 2626366, 2626367, 2626368, 2626369, 2626370, 2626371, 2626372, 2626373, 2626374, 2626375, 2626376, 2626377, 2626378, 2626379, 2626380, 2626381, 2626382, 2626383, 2626384, 2626385, 2626386, 2626387, 2626388, 2626389, 2626390, 2626391, 2626392, 2626393, 2626394, 2626395, 2626396, 2626397, 2626398, 2626399, 2626400, 2626401, 2626402, 2626403, 2626404, 2626405, 2626406, 2626407, 2626408, 2626409, 2626410, 2626411, 2626412, 2626413, 2626414, 2626415, 2626416, 2626417, 2626418, 2626419, 2626420, 2626421, 2626422, 2626423, 2626424, 2626425, 2626426, 2626427, 2626428, 2626429, 2626430, 2626431, 2626432, 2626433, 2626434, 2626435, 2626436, 2626437, 2626438, 2626439, 2626440, 2626441, 2626442, 2626443, 2626444, 2626445, 2626446, 2626447, 2626448, 2626449, 2626450, 2626451, 2626452, 2626453, 2626454, 2626455, 2626456, 2626457, 2626458, 2626459, 2626460, 2626461, 2626462, 2626463, 2626464, 2626465, 2626466, 2626467, 2626468, 2626469, 2626470, 2626471, 2626472, 2626473, 2626474, 2626475, 2626476, 2626477, 2626478, 2626479, 2626480, 2626481, 2626482, 2626483, 2626484, 2626485, 2626486, 2626487, 2626488, 2626489, 2626490, 2626491, 2626492, 2626493, 2626494, 2626495, 2626496, 2626497, 2626498

